

December 4, 2020

To,
The Manager
Dept. of Corporate Services
BSE Ltd.
25th Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Sub: Publication of Notice of 12th Annual General Meeting, Book Closure, Dividend

and Remote E-Voting information of the Company in Newspapers.

Ref: Shahlon Silk Industries Ltd. (BSE Script Code: 542862)

Dear Sir,

With regard to subject, please find enclosed herewith copies of newspapers in the matter of Notice of 12th Annual General Meeting, Book Closure, Dividend and Remote E-Voting advertisement, published in 'Gujarat Guardian' and 'The Financial Express' on 3rd December, 2020.

Kindly update this information on your website for investors/general public.

Thanking you.

For, Shahlon Silk Industries Limited

Hitesh K. Garmora Company Secretary

Encl.: As stated above

Reg. off: 91, G.I.D.C. Khatodara, Behind Sub-Jail, Ring Road, Surat-395 002, Gujarat, INDIA Tel.: +91 261 2635551 - 53 & 57

÷91 261 4190200 / 291

Fax: +91 261 2635552

CIN : L17120GJ2008PLC053464

E-mail: info@shahlon.com **Web**: www.shahlon.com

Form No. INC-25A

Before the Regional Director, Ministry of Corporate Affairs, Western Region In the matter of the Companies Act, 2013, Section 14 of Companies Act, 2013 and Rule 41 of the Companies (Incorporation) Rules, 2014

in the matter of M/s Atlas Copco (India) Limited having its registered office at Sveanagar, Dapodi, Mumbai-Pune Road, Pune - 411 012, India (the "Applicant Company")

Notice is hereby given to the general public that the Applicant Company intending to make an application to the Central Government under section 14 of the Companies Act, 2013 read with aforesaid rules and is desirous of converting into a private limited company in terms of the special resolution passed at the Annual General Meeting held on 27" November 2020 to enable the Applicant Company to give effect for such conversion. Any person whose interest is likely to be affected by the proposed change/status of the Applicant Company may deliver or cause to be delivered or send by registered post of his objections supported by an affidavit stating the nature of his interest and grounds of opposition to the Regional Director, Western Region, Ministry of Corporate Affairs, 5th Floor, Everest, 100 Marine Drive, Mumbai - 400 002, within 14 (fourteen) days from the date of publication of this notice with a copy to the Applicant Company at its registered office at the address mentioned below.

Atlas Copco (India) Limited Sveanagar, Dapodi, Mumbai-Pune Road, Pune - 411 012, India Date: 4 December 2020

For and on behalf of the Applicant Company Mr. Frans van Niekerk,

Managing Director DIN: 08633761

MOHOTA INDUSTRIES LIMITED

(Formerly Known as The Rai Saheb Rekhchand Mohota Spg. & Wvg. Mills Ltd.') Corporate Office: Post Box No. 1, Hinganghat, Dist. Wardha, Maharashtra - 442 301 Ph.: 07153-244282, 244039 FAX: 244753 Web: www.mohotaindustries.com E-mail: info@rsmm.com CIN: L99999MH1946PLC005261

NOTICE OF 73^{FD} ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE

AND REMOTE E-VOTING INFORMATION Notice is hereby given that

Place: Pune

- The 73th Annual General Meeting (AGM) of Mohota Industries Limited (Formerly-The Rai Saheb Rekhchand Mohota Spg. & Wvg. Mills Ltd.) will be held on Thursday the 24th day of December, 2020 at 10.30 A.M.(IST) at Devkaran Mansion, Gate No.2, 3rd Floor, 63 Princess Street, Mumbai - 400 002 to transact the business as set forth in Notice of AGM.
- The Company has dispatched the Notice & Annual Reports 2019-20 to those members whose name appears in the Register of Members as on 30th Oct, 2020, electronically to the members whose e-mail ID's are registered with the Company/Depository Participant(s). The Annual Report is also available on the website of the Company at
- Members holding shares either in physical form or dematerialized form as on the cut-off date i.e. 17th December, 2020 may cast their vote electronically on all the business as set out in the Notice of AGM, through electronic voting system of Central Depository Services (India) Limited from a place other than venue of the AGM. All the members are
 - The business as set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means.
- The remote e-voting shall commence on December 21, 2020 (9.00 A.M. IST) and shall end on December 23, 2020 (5.00 P.M. IST). The remote e-voting shall not be allowed beyond the said date and time.
- The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is December 17, 2020.
- Any person, who becomes member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e. December 17, 2020 may obtain the Login Id and password by writing to the Registrar and Share Transfer Agent of the Company at its email id viz. bhagwan@bigshareonline.com.
- Members who have cast their vote by remote e-voting prior to the AGM, may attend the AGM but shall not be entitled to cast their votes again. Members who have not cast their vote through remote e-voting may cast their vote at the AGM through
- a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on cut-off date shall only be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM
- The Notice of AGM is available on the Company's website www.mohotaindustries.com and website of CDSL i.e. www.cdslindia.com
- In case of any queries or issues regarding e-voting, members may refer to the Frequently Asked Question (FAQs) and e-voting user manual for members available a https://www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or to our Registrar and Share Transfer Agent M/s Bigshare Services Pvt. Ltd., 1st Floor, Bharat Tin Works Building, Opp. Vasant Oasis, Makwana Road, Marol, Andheri East, Mumbai-400 059, Phone No (022) 62638200/ 295, E-mail ID: bhagwan@bigshareonline.com.
- Pursuant to section 91 of the Companies Act, 2013, the Share Transfer Register will remain closed from 17th December 2020 to 24th December, 2020 (both days inclusive). for the purpose of AGM.

For Mohota Industries Limited

Place: Hinganghat Date: 03rd December, 2020

(Sachin Kanojiya) Company Secretary



Website: http://www.bfindia.com, E-mail: sec.shares@jbfmail.com CIN: L99999DN1982PLC000128

PUBLIC NOTICE - 38" ANNUAL GENERAL MEETING

This is to inform that in view of the outbreak of the COVID-19 pandemic, the 38th Annual General Meeting (AGM Meeting) of the Members of JBF Industries Limited ('the Company') will be convened through two-way Video Conference ('VC') / Other Audio-Visual Means ('OAVM'), in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder, read with General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as 'MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/CMD/1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular"). The 38th Annual General Meeting of the Members of the Company will be held on 30" December, 2020 at 11 30 a.m. (IST) through VC/OAVM facility provided by NSDL to transact the businesses as set out in the Notice

The e-copy of the Notice of the AGM along with the Annual Report of 2019-20 (Annual Report) of the Company will be available on the website of the Company www.Jbfindia.com and websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and the website of National Securities Depository Limited ('NSDL')

Members can attend and participate in the AGM ONLY through the VC/OAVM facility, the details of which will be provided by the Company in the Notice of the AGM. Accordingly, please note that no provision has been made to attend and participate in the 38" AGM of the Company in person, to ensure compliance with the directives issued by the government authorities with respect to COVID-19. Member's attending the meeting through VC / OAVM shall be counted for the purpose of reckoning the guorum under Section 103 of the Companies Act, 2013.

The Notice of the AGM along with the Annual Report will be sent electronically to those Members whose e-mail addresses are registered with the Company / Registrars & Transfer Agent ('RTA') / Depository Participants ('DPs'). As per the SEBI Circular, no physical copies of the Notice of the AGM and Annual Report will be sent to any Member, Members who have not yet registered their email addresses are requested to follow the process mentioned below, before 11.00 a.m. (IST) on 6" December, 2020, for registering their email addresses to receive the Notice of the AGM and Annual Report electronically and to receive the login ID and password for e-Voting:

NOTICE IS FURTHER GIVEN pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the Company is providing remote e-voting facility provided by NSDL to its shareholders in respect of the business to be transacted at the ensuing AGM. The details for remote e-voting are as given below:

(1) The remote e-voting commences on Sunday, 27th December, 2020 at 9.00 a.m. and ends on Tuesday, 29th December, 2020 at 5.00 p.m. The remote e-voting module will be disabled for voting thereafter.

(2) The voting rights of the Members shall be in proportion to their share of the paid-up equity share capital of the Company as on Wednesday, 23rd December, 2020 ('Cut-Off Date'). The facility of remote e-voting shall also be made available during the Meeting and the Members attending the Meeting, who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right during the Meeting. A person whose name is recorded in the Register of Members/Register of Beneficial Owners as on the Cut-Off Date only shall be entitled to avail the facility of remote e-voting before/during the AGM

(3) Any person who acquires shares and becomes a Member of the Company after the dispatch of the Notice of AGM and holds shares as of the cut-off date, may obtain the login ID and password for remote e-voting by sending a request to NSDL at evoting@nsdl.co.in or may contact the toll-free number provided by NSDL: 1800-222-990. A person who is not a Member as on the cut-off date should treat the Notice of the AGM for information purpose only

(4) The Members who have already cast their votes by remote e-voting prior to the AGM will have right to participate at the AGM but shall not be entitled to cast their votes again on such resolution(s) for which the Member has already cast the vote through remote e-voting prior to the AGM.

Members who have not registered their e-mail addresses are requested to follow the below process for registering their e-mail addresses and to receive login ID and a) In case shares are held in physical mode - kindly provide Folio No., Name of

shareholder, scanned copy of the share certificate (front and back), Self-attested scanned copy of valid PAN card and Self attested scanned copy of Aadhar Card by email to sec.shares@jbfmail.com and rnt.helpdesk@linkintime.co.in.

b) In case shares are held in demat mode - kindly provide DP id Client id, Name, Client Master or copy of Consolidated Account statement, Self-attested scanned copy of valid PAN card and Self attested scanned copy of Aadhar Card by email to sec.shares@jbfmail.com and rnt.helpdesk@linkintime.co.in

NOTICE IS ALSO HEREBY GIVEN pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Shareholders and the Share Transfer Books of the Company will remain closed from Wednesday, 23rd December, 2020, to Wednesday, 30th December, 2020 (both days inclusive) for holding Annual General Meeting.

For JBF Industries Limited Mrs. Ujiwala Apte Place: Mumbai Company Secretary Date: 03rd December, 2020

GOVERNMENT OF TAMIL NADU PUBLIC WORKS DEPARTMENT Buildings (C&M) circle, (Medical Works), Madurai - 625 002. **Tender Cancellation** Notification

Due to Administration reasons tender hereby cancelled for the works mentioned in this office Tender Notice No:13SE/BCMC (MW)/ MDU/2020-2021/Dt: 01.12.2020.

Superintending Engineer, PWD, Bldgs (C&M) Circle, (Medical Works), Madurai DIPR / 4497 / TENDER / 2020

WESTERN RAILWAY WESTERN RAILWAY

E-TENDER FOR PROCUREMENT

OF HYDRAULIC TRACK JACK

Chief Engineer, Western Railway,

Churchgate invites the following É

Procurment Tender: (1) Tender No.:

W628031933A (2) Description of

Stores tender: Procurement of Hydraulic

Track Jack 15T capacity (Non Infringing

Type) as per RDSO specification no.

TM/SM/31, dated: 08.05.1996. (3) Total

Quantity in Nos.: 73 (4) Total Tender

Value: ₹3,10,104/- (5) Earnest Money:

Exempted (6) Date of Closing of e-

tender box at 11.00 Hrs.: 05.01.2021 (7)

Date of Opening of e-Tender box at

11.15 Hrs.: 05.01.2021. Note: The

complete information along with tender

document of above e-procurement

Tender is available on website

https://ireps.gov.in. upto the due date of

Like us on : f facebook.com/WesternRly

E-TENDER FOR

GIS MAPPING WORK (1) Executive: DEN (CENTRAL) BCT (2) Tender Notice No. & Date: BCT/20-21/274, Date: 02.12.2020 (3) Work & Location: Mumbai Division- GIS Mapping of Indian Railways Off Track Assets e.g. land, building, colonies, workshops, hospitals, etc. using GPS based hand-held devices. (4) Approx Cost of Work: ₹20,52,780/- (5) EMD: ₹41,100/- (6) Date & Time for Submission and Opening of e-Tender: Submission upto 15.00 Hrs. on 24.12.2020 and Opening on same date at 15.30 Hrs. Note: Regarding detailed nature of work, containing cost of tender document (non-refundable), EMD, eligibility criteria, similar nature of work, detailed tender conditions, please visit www.ireps.gov.in. Manual Offers will not be considered.

Like us on : f facebook.com/WesternRly

SHAHLON SILK INDUSTRIES LTD.

D-0471

Regd. Office:, 91, GIDC, Khatodara, B/h. Sub-Jail, Ring Road, Surat - 395 002 CIN: L17120GJ2008PLC053464 | Tel No.: +91-261-419 0200 Fax: +91-261-263 5550 E-mail: info@shahlon.com | Website: www.shahlon.com NOTICE OF 12TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE.

DIVIDEND AND REMOTE E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 12th Annual General Meeting (AGM) of the members of Shahlon Silk Industries Ltd. will be held on Saturday, December 26, 2020 at 11.00 a.m.(IST) through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM) to transact the business as set out in the Notice of the 12th AGM. The Notice calling the 12th AGM along with the Annual Report for the financial year 2019-2020 is sent through electronic mode to those Members whose e-mail addresses are registered with Depository Participant (for shareholding in demat mode) or the Company/it's Registrar and Transfer Agent

 Bigshare Services Pvt. Ltd. (Bigshare) (for shareholding in physical mode). Pursuant to Section 91 of the Companies Act. 2013 and Rules made thereunder and Regulation 42 of SEBI Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 12th December, 2020 to 26th December, 2020 (both days inclusive) for the purpose of determining the shareholders who shall be entitled for dividend for the year ended 31st March, 2020, if approved by the shareholders at the 12th

Members may note that the Board of Directors at its Meeting held on 11th July, 2020 has recommended a Dividend of Re. 0.25 per share (2.5%) for the year ended 31st March, 2020. The dividend, if approved, by the Members at the AGM, will be paid electronically to Members who have updated their bank account details for receiving dividend through electronic means. For Members who have not updated their bank account details, dividend warrants/demand drafts will be sent to them in due course of time and upon normalization of postal services.

Pursuant to Finance Act, 2020, dividend income will be taxable in the hands of the shareholders w.e.f. 1st April 2020 and the Company is required to deduct tax at source ("TDS") from dividend paid to the Members at prescribed rates in the Income Tax Act, 1961 ("the IT Act"). For the prescribed rates for various categories, conditions for Nil/preferential TDS and details/documents required thereof, Members are requested to refer to the IT Act and Notice of the AGM in this regard which is mailed to the members.

In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014, as amended and Regulation 44 of SEBI Listing Regulations and SS-2 issued by the Institute of Company Secretaries of India (ICSI) read with MCA Circulars and SEBI Circular, the Company is providing remote e-Voting facility to its Members in respect of the business / resolutions as set forth in the Notice of AGM to be transacted at the AGM and facility for those Members participating in the AGM to cast vote through e-Voting system during the AGM provided by CDSL.

The cut-off date for the purpose of remote e-voting, voting at the AGM and for participation in AGM shall be 18th December, 2020.

(2) The remote e-voting period begins on 23rd December, 2020 (9.00 a.m. IST) and ends on 25th December, 2020 (5.00 p.m. IST). Remote E-Voting shall not be allowed beyond the said date and time.

(3) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting, e-voting at the AGM and participating in the 12th AGM through VC/OAVM facility.

(4) Eligible members who have acquired shares after sending the notice and holding shares as on the cut-off date 18th December, 2020 may approach the Company for issuance of the User ID and Password for exercising their right to vote by electronic means and attend the meeting through VC/OAVM. However, if you are already registered with CDSL for remote e-Voting then you can use your existing user ID and password for casting your vote.

(5) The members who have casted their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote

(6) The Company has appointed Mr. Bhairav H. Shukla, Practicing Company Secretary (Membership No. FCS 6212) as the Scrutinizer to scrutinize the remote e-voting and e-voting at AGM in a fair and transparent manner.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi

This Notice is also available on the Company's website www.shahlon.com and on the website of CDSL www.evotingindia.com.

Under authority of the Board of Directors of Shahlon Silk Industries Ltd. Hitesh K. Garmora

Place : SURAT Date: December 03, 2020 Company Secretary

IL&FS Transportation Networks Limited

Regd. Off: The IL&FS Financial Centre, Plot no. C-22, G-Block, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai 4000 051; Tel. No.: +91 22 2653 3333, Facsimile: +91 22 2652 3979; Email: itnlinvestor@ilfsindia.com, Website: www.itnlindia.com; CIN: L45203MH2000PLC129790

CORRIGENDUM NOTICE

Pursuant to the notice published on November 29, 2020, intimating the scheduling of the meeting of the Board of Directors on Saturday, December 05, 2020, it is hereby informed that the said meeting has been re-scheduled to Monday, December 07, 2020 inter alia, to consider, approve and take on record Audited Financial Results for the financial year ended March 31, 2020.

For IL&FS Transportation Networks Limited

Mumbai, December 03, 2020

इंडियन बैंक 🚲 Indian Bank

Place : Ahmedabad

FORM NO. INC-26

[Pursuant to Rule 30 of Companies

(Incorporation) Rules 2014]

Advertisement to be published in Newspaper

for the change in Registered Office of the

Company from one state to another

Before the Central Government

Western Region, Mumbai

In the matter of sub-section 4 of

section 13 of the

Companies Act 2013 and clause (a)

of sub-section (5)

of Rule 30 of the Companies

(Incorporation) Rules 2014

In the matter of M/S KAJAL EXPORTS PRIVATE

LIMITED having its Registered Office at C/77,

Anjali Kiran Society, Vakola Bridge Nehru

Road, Santacruz East Mumbai MH 400055

(Petitioner)

Notice is hereby given to General Public that

the company proposes to make the application

to the Central Government under section 13 of

the Companies Act 2013, seeking confirmation

of alteration of Memorandum of the company

in term of special resolution passed at Extra

ordinary General Meeting held on TUESDAY,

6th DAY OF OCTOBER 2020 to enable the

company to change its Registered Office from

Any person whose interest is likely to be affected

by the proposed change, may deliver either on

MCA portal (www.mca.gov.in) by filling

investor complaint form or cause to be deliver

or send by registered post of his/her objections

supported by an affidavit stating the nature of

his/her interest and ground of opposition to the

Regional Director at the Address EVEREST 5TH

400002, within 14 Days of date of publication

of this notice with a copy to the applicant

company at its registered office at the address

ADDRESS OF REGISTERED OFFICE: C/77, Aniali

Kiran Society, Vakola Bridge Nehru Road,

Santacruz East Mumbai Mumbai City MH 400055.

R. G. D'SILVA

Company Secretary & President (Legal)

For and on behalf of applicant

SANIL PRAKASH SAHU

Date-1st December, 2020

(DIRECTOR)

Place-Delhi

DIN: 00335201

KAJAL EXPORTS PRIVATE LIMITED

FLOOR, 100 MARINE DRIVE, MUMBAI

"Mumbai" to "State of Delhi".

mentioned below:

Bapunagar Branch : 1st Floor, Kariya Complex Viratnagar Cross Road, NH No. 8, Odhav, Ahmedaba Ph.: 079-22892120

[Under Rule (8(1) of Security Interest (Enforcement) Rules, 2002] Possession Notice (for Immoveable property)

Whereas, The undersigned being the Authorised officer of the Indian Bank (eALB) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) (read with Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 11.09.2019 calling upon the borrower Amatives (Proprietorship firm, Borrower), Late Mr. Mukesh Manilal Patel (Proprietor, Guarantor & Mortgagor) through his legal heirs, Mrs. Bhavnaben Mukeshbhai Patel(Legal Heir cum widow of Late Mr. Mukesh Manilal Patel), Ms. Dimpi Mukeshbhai Patel(Legal Heir cum daughter of Late Mr. Mukesh Manilal Patel), Mr. Deep Mukeshbhai Patel (Legal Heir cum son of Late Mr. Mukesh Manilal Patel) and Mr. Rajesh S Patel (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 45,59,171/- (Rupees Forty Five Lac Fifty Nine Thousand One Hundred Seventy One only) as on 10.09.2019 within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/Mortgagors [(Legal Heirs of Late Mr. Mukesh Manilal Patel (Proprietor, Guarantor & Mortgagor)]/Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Mortgagors [(Legal Heirs of Late Mr. Mukesh Manilal Patel (Proprietor, Guarantor & Mortgagor)]/Guarantors and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with Rule 8 of the said rules on 4th day of January of the year Two Thousand Twenty.

The Borrowers/Mortgagors [(Legal Heirs of Late Mr. Mukesh Manilal Patel (Proprietor, Guarantor & Mortgagor)]/Guarantors in particular and the public in general are hereby cautioned not to deal with this property and any dealings with the property will be subject to the charge of Indian Bank (eALB) Bapunagar Branch for an amount Rs. 45,59,171/-(Rupees Forty Five Lac Fifty Nine Thousand One Hundred Seventy One only) as on 10.09.2019 and future interest & expenses thereon.

The borrowers attention is invited to the provision of subsection 8 of Section 13 of the Act in respect of time available, to redeem the secured assets. **Description of Immovable Property**

All that piece and parcel of the freehold immovable property situate at Shed No. 63 Paikee Shed No. 63/3, admeasuring 103.10 square meter and construction thereon admeasuring built up area of 53.81 square meter along with undivided share of land in Shri Harikrupa Industrial Park lying on Block No. 563 (Old Survey No. 106/1+2+3), draft T.P. No. 116, Final Plot No. 75 at mouje Hathijan under Sub District and District of Ahmedabad, within the state of Gujarat, standing in the name of Late Mr. Mukesh Manilal Patel. The boundaries of the Property are: North: Road of the Society, South: Adjoining Survey number, East: Unit No. 63/4, West: Unit No. 63/2 Chief Manager cum Authorised Officer Date: 01.12.2020

For Indian Bank (eALB)

Bank of India

Relationship beyond banking



Name of

M/s Ali

Enterpri

Krishna Ghag

Company Secretary

UCO BANK, Hadapsar Branch SNo. 225/9B, Jiyaji Manison, First Floor, Pune Solapur Road, Gadital, Hadapsar 411028.

VEHICLE FOR AUCTION

Hypothecated Vehicle taken possession by Bank will be sold through Auction on 19/12/2020 (Saturday). Intending purchasers are requested to send bids in sealed cover to the Branch Address above along with earnest money to reach the Branch on or before 19/12/2020, 11.00 a.m.

Borrower	Outstanding	Description of the Vehicle
ises	Rs.6,66,573/- (Rs. Sx Lakh Sixty Six Thousand Five Hundred Seventy Three only)	Registration No: MH 12 PQ 9229, Year 2017, Toyota Etios 1.2 G, Engine No. 2NRD138735, 4 Wheel Drive Drive Fuel: Petrol/CNG, 1197 CC, 1,79,386 K.M. running

A) Reserve Price 1,09,200/- (One Lakh Nine Thousand Two Hundred Only) B) Earnest Money Deposit (EMD) 10,920/- (Ten Thousand Nine Hundred Twenty Only)

Terms & Conditions:

 Bidder has to submit his KYC documents along with the Bid. 2) Applicant to mention the Bid Amount which should not be less than the

reserve price & deposit earnest money in the form of Demand Draft / Pay Order payable to UCO Bank Hadapsar Branch, payable at Pune. 3) The bids will be opened on 19/12/2020 at 11.00 A.M. in the Branch

premises before all the bidders. The borrower/ Guarantor also can participate/ present for the Auction. 5) The vehicle is sold in "As is Where is" and "As is What is" condition and the intending bidder should make discreet enquiries as regards on the vehicle of any authority besides the banks charges and should satisfied themselves about the title, extent, quality of the vehicle Before submitting

their bid. No claim of whatsoever nature regarding the vehicle put for sale charges, encumbrances over the vehicle on any other matter etc. will be entertained after submission of the bid. 6) The purchaser shall bear the stamp duties charges including those of sale certificate registration charges, all statutory dues payable to Government, taxes and rates and outgoing both existing and future

of successful bidder. 7) The successful bidder shall have to pay 25% of the purchase amount including earnest money) already paid, immediately on closure of the Auction Sale proceedings on the same day of the Sale in the same mode as stipulated in Clause 2 above. The balance 75% of the purchase price shall have to be paid within 15 days of acceptance/confirmation of sale conveyed to them. In case failure to pay the amount the earnest

relating to the property. The sale certificate will be issued only in the name

money/Advance money will stand forfeited. 8) The EMD of unsuccessful bidder will be return on the closure of the auction sale proceedings.

9) The undersigned has the absolute right and discretion to accept or reject any bid or adjourn/postpone/cancel the sale/modify any terms and conditions of the sale without any prior notice and assigning any reasons. The sale is subject to confirmation by the Bank, if the borrower/guarantor pays the bank in full before sale, no sale will be conducted

 For further details & inspection of the vehicle, please contact on 8378017868 / 9049435441 between 11 am. to 3 pm. on 08/12/2020.

Place : Pune, Date : 03/12/2020 Branch Manager

> Pune (Main) Branch: 8A-Coyaji Road, Pune - 411001 Ph: 020-26362540, 26334331 Email: pune.pune@bankofindia.co.in, "punecredit.pune@bankofindia.co.in"

APPENDIX-IV [See rule-8(1)] POSSESSION NOTICE (for Immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of the Bank of India, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Sec. 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices calling upon the following Borrowers to repay the amounts mentioned in the notices together with further interest thereon within 60 days from the date of receipt of the said Notice. The Borrowers having failed to repay the amount, Notice is hereby given to the Borrowers and the Public

8 of the Security Interest Enforcement) Rules, 2002 on the dates mentioned below. The Borrowers in particular and the Public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of the Bank of India for the amounts mentioned below and interest thereon.

in general that the undersigned has taken possession of the properties described herein below in

exercise of powers conferred on him/her under Sub Section (4) of section 13 of the said Act read with rule

The Borrower's attention is invited to the provisions of Sub Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr.	N	Outstanding Amount	Date of Demand Notice	
No. Name of Borrowers		in Rs.	Date of Possession	
1		: Mr. Arjun Rs. 30,05,650.80 (in words Rupees Thirty Lakhs		
C	Chandrasen Nikam	Five Thousands Six Hundred Fifty and Paise Eighty) plus interest from 30/11/2019	02/12/2020	

Details of Immovable Property: All that part and parcel of the property described as Flat No. 503, admeasuring area 42.47 Sq mtrs, Carpet + Terrace 11.24 Sq. Mtrs situated at fifth floor Building No. A-1, together with car park Space No. 82, Constructed at Survey No. 54/1, Harit Shilp, Village Rahatani, Pune bought from Builder (Shreeram Associates) Bounded-On the North by: Open Space and Road, On the South by: Open Space, On the East by: Lift, On the West by: Flat No. 502

Borrower: Mrs. Pallavi Rs. 37,27,624.32 (in words Thirty Seven Lakhs) 09/12/2019 Twenty Seven thousands Six Hundred Twenty Four Utkarsh Patil 02/12/2020 and paise Thirty Two) plus interest from 30/11/2019 Details of Immovable Property: All that part and parcel of the property described as Flat No. 103,

admeasuring area 56.31 Sq mtrs, Carpet + Terrace 11.24 Sq. mtrs, situated at First Floor, Building No. A-2, together with Car Park Space No. 20 constructed at Sr. No. 54/1 (part), Harit Shilp, within the limits of the Pimpri Chinchwad Municipal Corporation and within the sub registrar district of Haveli, Rahatani, Pune-411001, Maharshtra. Bounded - On the North by: A-1 building and open space, On the South by: Flat No .102 of Building No. A-2, On the East by: Open Space, On the West by: Open Space

Date: 02/12/2020 Authorized Officer, Bank of India, Pune Main Branch Place: Pune

П muthoot

MUTHOOT HOUSING FINANCE COMPANY LIMITED Registered Office: TC NO.14/2074-7, Muthoot Centre, Punnen Road, Thiruvananthapuram - 695 034. CIN NO - U65922KL2010PLC025624, Corporate Office: 12/A 01, 13th floor, Parinee Crescenzo,

Plot No. C38 & C39, Bandra Kurla Complex-G block (East), Mumbai-400051 TEL. NO: 022-62728517 PUBLIC NOTICE - AUCTION CUM SALE OF PROPERTY

Sale Of Immovable Assets Under Securitization And Reconstruction Of Financial Assets & Enforcement Of Security Interest Act, 2002 In exercise of powers contained in the Securitization and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002, the Authorized Officer of the M/s Muthoot Housing Finance Company Ltd., (hereinafter referred to as the "Company") has taken the possession of under mentioned properties (hereinafter referred to as "Secured Asset") and held as security in respect of HOUSING Loan facilities granted to below mentioned customers (hereinafter referred to as "Borrowers") and further It has been decided to sell the Secured Asset on "as is where is", "as is what is", "whatever there is" and "no recourse" basis/conditions by inviting sealed tenders from public in respect of the secured debt amounting to amount in below with further interest and expenses thereon till final payment of the overdue from Borrowers.

Sr. No.	Name of Borrower / Co-Borrower/ Guarantor	Description of Mortgaged Property	Property Possession Date	Outstanding Amount	Reserve Price (Rs.)	E.M.D. (Rs.)
1	Bhavesh Ashok Trivedi Sunitaben Ashokbhai Trivedi Lan No :- 12100075992	HOUSE 603,RABARI VAS,MOUJE - RANASAN,NR VISATMA TEMPLE, CEMENTED ROAD,VEHLAL B.O,GUJARAT,382330	Commence of the Commence of the	Rs. 846827.16/- AS ON DATE 14-03-2019	900000/-	90000/-

Inspection Date & Time: 18-12-2020 & 21-12-2020 at 10.00 AM to 05.00 PM, Sale Date, Time & Place: 04-01-2021 at 10.00 AM to 05.00 PM Muthoot Housing Finance Co Ltd,304 3rd Floor, Third Eye Complex, Above saraswat Bank Panchwati cross Road, CG Road, Ahmedabad - 380009. Dhrumil Joshi - 9104455596

Intending bidders may inspect the properties on the date and time as mentioned above. Terms & Conditions of public auction:-1) Sale is strictly subject to the terms and conditions mentioned hereunder as also the terms and condition mentioned in the offer/ tender document to be submitted by the intending bidders. 2) The property will be sold on "As is where is" and "As is what is" "whatever there is" and "no recourse condition, including encumbrances, if any. 3) The properties under auction can be inspected on the date & time specified above. For any queries with regards to inspection of properties or submission of tenders, kindly establish contact to The Authorised Officers at respective locations on above mention contact numbers. The interested buyers may send theirs offers for the above property in a sealed cover along with Demand Draft Payable a Mumbai favoring "Muthoot Housing Finance Company Limited", towards earnest money deposit (EMD) 10% of Reserve Price at the above mentioned office address of The Authorised Officer on one working day before the date of Auction. 4) Offers that are not duly filled up or offers not accompanied by the EMD or Offers received after the above date and time prescribed herein will not be considered / treated as invalid offers, and accordingly shall be rejected. The Earnest money deposit shall not carry any interest. 5) Along with offer documents, the intending bidder shall also attach a copy of the PAN card issued by the Income Tax department AND bidder's identity proof and the proof of residence such as copy of the Passport, Election Commission Card, Ration Card, Driving license etc. 6) In no eventuality the property would be sold below the reserve price. 7) The bidders present in the auction would be allowed to increase their offer multiples of Rs. 10000/- in addition to Reserve Price fixed. 8) The Property shall be sold to the highest bidder. offer, subject to acceptance of the bid by the secured creditor, i.e., M/s Muthoot Housing Finance Company Ltd. The undersigned has the discretion to accept or reject any offer / Tender without assigning any reason. 9) All dues and outgoings, i.e., Municipal Taxes, Maintenance / Society Charges, Electricity and water taxes or any other dues including Stamp Duty, Registration Charges, Transfer Charges and any other expenses and charges in respect of the registration of the Sale Certificate in respect of the said properties shall be paid by the successful bidder/purchaser. 10) The successful bidder/purchaser shall have to pay 25% of the purchase amount (after adjusting the E.M.D. already paid) within 2 working days from the acceptance of the offer by the Authorized Officer in respect of the sale, failing which, the earnest money deposit will be forfeited. 11) The balance 75% of the Sale price shall have to be paid within 30 days of conveying the confirmation of the sale to the successful Purchaser by the Authorized Officer or such extended period as agreed upon in writing by and solely at the discretion of the Authorized officer. In the event of the default in payment of the balance 75% of the sale price or any part thereof, within the prescribed period, the amount deposited shall be forfeited and the secured creditor will be at liberty to sell the property once again and the defaulting Purchaser shall forfeit all claims to the property or to any part of the sum already paid towards the purchase thereof. 12) The Demand draft / Pay order deposited towards the Earnest money shall be returned to unsuccessful bidders. 13) The immovable property described herein above shall remain and be at the sole risk of the successful purchaser in all respects including loss or damage by fire or theft or other accidents, and other risk from the date of the confirmation of the Sale by the undersigned Authorized Officer. The successful bidde shall not be entitled to annul the sale on any ground of whatsoever nature. 14) The Authorized officer is not bound to accept the highest offer or any or all offers and M/s Muthoot Housing Finance Company Ltd., as secured creditor, reserves its right to reject any or all bid(s) without assigning any reasons In case, the bids are rejected, Authorized officer can negotiate with any of the tenderer or intending bidders or other parties for sale of the property b private treaty. 15) No persons other than the intending bidders/offerer themselves, or their duly Authorized representative shall be allowed to participate in the auction/sale proceedings. 16) The Authorized officer reserves his right to vary any of the terms and condition of this notice for sale without prior notice, at his discretion. 17) In case, all the dues together with all cost, charges and expenses incurred by the Secured Creditor are tendered by the above name borrower / co-borrower till one working day prior to the date of Auction then the property will not be sold and all the bids received from the prospective bidders shall be returned to them without any liability / claim against M/s Muthoot Housing Finance Company Ltd. The borrower/guarantor/mortgage of above LAN no. are hereby given STATUTÓRY 30 DAYS NOTICE UNDER RULE6(2), 8(6) & 9(1) OF SARFAESI ACT to discharge the liability in full and pay the dues as mentioned above along with upto date interest and expenses within above mentioned days from the date of this notice failing which the Secured Asset will be sold as per the terms and conditions mentioned above. In case there is any discrepancy between the publications of sale notice in ENGLISH and VERNACULAR newspaper, then in such case the English newspaper will supersede the vernacular newspaper and it shall be consider as the final copy, thus removing the ambiguity. If the borrower / guarantor/mortgagers pays the amount

due to Bank, in full before the date of sale, auction is liable to be stopped.

Place : Gujarat, Date: 04/12/2020

For Vedanta Limited Prerna Halwasiya

FINOLEX CABLES LIMITED

Regd. Office: 26 / 27, Mumbal-Pune Road, Pimpri, Pune 411018. | CIN: L31300MH1967PLC016531 | Email: investors@finolex.com LOSS OF SHARE CERTIFICATE

Notice is hereby given that the following original share certificate have been reported to be lost misplaced and the Company has been requested to issue duplicate share certificate in lieu thereof. Please note that, if no objection is received at the registered office of the Company within 7 days from the publication of this notice, duplicate share certificate will be considered for issue by the Company to the respective shareholder:

Folio No.	Name of the Shareholder	Share Certificate No.	Distinctive Numbers	No. of Shares
D-1983	DIPTI SHAH KETAN SHAH	500704	119007021 - 119008020	1000
			For FINOLEX CABLES	LIMITED



Place : Pune

Dated: 04" December, 2020

VEDANTA LIMITED

CIN: L13209MH1965PLC291394 Regd. Office: 1" Floor, 'C' Wing, Unit 103, Corporate Avenue, Atul Projects, Chakala, Andheri (East), Mumbai - 400093 Phone No.: +91-22 6643 4500; Fax: +91-22 6643 4530; Website: www.vedantalimited.com; Email ID: comp.sect@vedanta.co.in

NOTICE

NOTICE is hereby given that the following Share Certificates of face value Re.1/- of the Company as per details given hereunder have been reported LOST/MISPLACED and if NO OBJECTION is received within 15 days from the date of publication of this Notice, we shall consider issuance of Duplicate Share Certificates thereof:

S.	Folio	Name	Certificate No.	No. of shares	Distinctive Numbers	
No.					From	To
1	SGL121942	Sachin Gopal Joshi Gopal Trimbak Joshi	1094538	10872	2768203355	2768214226
2	SGL115958	Nitaa Narayan Burye Narayan Srinivassa Burye	835748	400	867393284	867393683
3	SGL115660	Narayan Srinivassa Burye Nita Narayan Burye	835747	400	867392884	867393283
4	SGL107228	Kirti Kumar Manilal Buddhadev Navneet Manilal Buddhadev	827272	364	863485464	863485827
5	A 004513	Amrit Lal	814180	6900	381816381	381823280
	476000000000000000000000000000000000000	H-000000000000000000000000000000000000	narranes Const.	6900	775436581	775443480

Company Secretary & Compliance Officer

Date: December 03, 2020

Place: New Delhi

financialexp.epapr.in

Ahmedabad

Sd/- Authorised Officer, For Muthoot Housing Finance Company Limited

ગુજરાતમાં સ્થિતિ યથાવત: વધુ ૧૩નાં મોત સાથે મૃત્યુઆંક૪૧૮૧થયો, નવા૧૫૪૦પોઝિટિવકેસ

દિનપ્રતિદિન વધતા જાય છે. ડિસેમ્બર રાજકોટમાં ૧૪૧, ગાંધીનગરમાં ૭૫, સહિતના ૩ દિવસ દરમિયાન ૪૫૨૯ માસમાં ૧ થી ૩ તારીખ સુધીમાં સતત જામનગરમાં ૪૧, જુનાગઢમાં ૨૩, કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યા છે. થઈને કુલ ૫,૩૩,૫૪૮ વ્યક્તિઓને હોમ બીજા દિવસે કોરોના સંક્રમિતના કેસો ભાવનગરમાં ૨૦, મહેસાણામાં ૬૯, હજુ પણ ગુજરાતમાં ૧ મિનિટે ૧ કરતા ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આમ ૧૫૦૦ ઉપર નોંધાવા પામ્યા છે. વિતેલા પાટણમાં ૪૨, ખેડામાં ૩૯, બનાસકાંઠામાં વધુ કોરોના કેસ નોંધયા છે. ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૫૪૦ મોત નિપજ્યા છે જેને લઈને અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક ૩૬, કચ્છમાં ૩૦, મોરબીમાં ૨૯, ૪૧૮૧ ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં અમરેલીમાં ૨૭, દાહોદમાં ૨૪, ભરૂચ ગુજરાતમાં ૧૩ કોરોના દર્દીના મૃત્યુ હાલ એક્ટિવ કેસ ૧૬૭૦૧ છે જેમાં ૯૬ અને અમરેલીમાં ૨૭, દાહોદમાં ૨૪, ભરૂચ નીપજ્યા હતા. જેમાં સૌથી વધુ અદાવાદમાં દરમિયાન ગુજરાતમાં ૧૪૩૫ કોરોના

ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાયના મહિસાગરમાં ૧૬, સુરેન્દ્રનગરમાં ૧૫, ૧૫૪૦ કોરોના સંક્રમિતના કેસ નોંધાવા અને દેવભૂમિદ્વારાકમાં ૪-૪, પોરબંદરમાં પામી છે. ૬૯,૭૩૫ લેબોરેટરી ટેસ્ટ સાથે દર્દીનો સમાવેશ થાય છે.

ેકેસો ૩૬, સુરતમાં ૨૪૬, વડોદરામાં ૧૮૪, નોંધાવા પામ્યા છે. આમ ગુજરાતમાં આજ ટેસ્ટ થવા પામ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં

બીજી બાજુ વિતેલા ૨૪ કલાક

કોરોના સંક્રમિતના કેસ નોંધાતા અત્યાર કુલ પોઝિટિવ દદીઓની સંખ્યા ૨૧૪૫૦૪ ઉપૂર પહોંચી: વધ્ સુધીમાં ગુજરાતમાં કુલ કોરોનાના કેસનો આંક ર.૧૪ લાખ ઉપર અર્થાત ર,૧૪,૫૦૪ થયો છે. િવતેલા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૩ કોરોના દર્દીના મહાત આપીને સારા થઈ ગયાં, હજુ ૧૬૭૦૧ સારવાર હેઠળ

િવતેલા ૨૪ કલાક દરમિયાન હોમ ક્વોરેન્ટાઈનમાં વધારો થવા પામ્યો છે.

અને પંચમહાલમાં ૨૩-૨૩, સાબરકાંઠામાં ૯, સુરતમાં ૨ જ્યારે રાજકોટ અને દર્દીઓ કોરોનાને મહાત આપવામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ૨૨, આણંદમાં ૨૦, નર્મદામાં ૧૭, વડોદરામાં ૧-૧ મૃત્યુ નોંધાવા પામ્યું છે. સફળ થયા છે. જેમાં અમદાવાદના વિતેલા ૨૪ કલાક દરમિયાન રાજ્ય ૩૪૩, સુરતના ૨૯૬, વડોદરાના ૨૦૧, તમામ જિલ્લામાં થઈને ૧૫૪૦ કોરોના અરવલ્લી અને ગીર સોમનાથમાં ૯-૯, સરકાર દ્વારા ૭૦ હજારથી નીચે લેબોરેટરી રાજકોટના ૧૩૦, મહેસાણાના ૪૨, સંક્રમિતના તમામ જિલ્લામાં થઈને નવસારી અને વલસાડમાં ૬-૬, બોટાદ ટેસ્ટ કરવાની પરંપરા યથાવત રહેવા ગાંધીનગરના ૬૯ અને મહીસાગરના ૪૨



ઇન્ડિયા રીસર્જન્સ એઆરસી પ્રાઇવેટ લિમિટેડ India RF

[(પરિશિષ્ટ-૪) રૂલ ૮(૧)] આથી નીચે સહીં કરનાર મેસર્સ ઇન્ડિયા રીસર્જન્સ એઆરસી પ્રાઇવેટ લિમિટેડ (આઇઆરએઆરસી) , કે જે એક એસેટ્સ રીકન્સ્ટ્રકશન કંપની (જે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં **નોંધાયેલી છે**) જેની રજીસ્ટર્ડ ઓફીસ ત્રીજે માળે, ચુનિટ નં. 30૪, પીરામલ ટાવર,પેનિન્સ્ કોર્પેરિટ પાર્ક, લોઅર પ્રેરલ, મુંબઇ ૪૦૦૦૧૩ (જે હવે પછી 'આઇઆરએઆરસી' તરીકે ઓળખા ni અધિકૃત અધિકારીએ સીંક્યુરીટાઇગ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્ર એન્ડ એનફોર્સેમ્સ્ટ ઓફ સીક્યુરીટી ઇન્ટ્રેસ્ટ એક્ટ ૨૦૦૨ (પજ ઓફ ૨૦૦૨) તથા સીક્યુરીટી ઇન્ટ્રસ્ટ (એનફોર્સેમ્સ્ટ) રૂલ, ૨૦૦૨ના ખંડ ૧૩(૧૨)ના રૂલ 3 અંતર્ગત આપવામાં આવેલી સત્તાન ઇપયોગ કરતા તા.૧૧-૦૬-૨૦૨૦ ના રોજ નીચેના દેવાદરોને ડિમાન્ડ નોટીસ આપવામાં આવી હતી ઉપયોગ કરતા તા.૧૯-૦૬-૨૦૨૦ ના રાજ નારના દ્વાદરાન ડિમાન્ડ નાટાસ આપવામાં આવા હતા. ૧. પ્રકાશ વિક્ત મિલ્સને તેમના માલિક મહેન્દ્ર કુમાર મોહનવાલ સાંખલેશ છે. તેમના દ્વારા તેમને રજીસ્ટર્ડ ઓફીસ પ્લોટ નં. ૧૦૫૮, રોડ નં. ૮૬, જીઆઇડીસી, સચીન, એચડીએફ્સી બેંકની પાસે, સુરત ગુજરાત ૩૯૪૧૦ તથા તેઓ અહીં પણ એ/૩, ૮૦૩, સ્થસ્તીક સ્સીડેન્સી, ઓમ દર્શનની પાસે, પાંદાર રેસીડેન્સીની મામે, ન્યુ સીટીલાઇટ કેનાલ રોડ, તેસુ સુરત ગુજરાત. ૨ મહેન્દ્રકુમાર મોહનલાલ સાંખલેયા તે પૂત્ર મોહનલાલ જશમલ સાંખલેયા. ૩. અભચમતિ સાંખલેયા તે પત્ની પ્રકાશકુમાર. **૪. અનુશ્રી ક્રિએશન** દુકાનનં ૨, રાઠી પેવેસ, રીંગ રોડ, ઉમરવાડા,સુરત, ગુજરાત ૩૯૫૦૦૨. ૫. પ્રકાશકુમાર મોહનલાલ સાંખલેચા તે પુત્ર મોહનલાલ જશમલ સાંખલેચા **તે બધાજ** સ્**ઢેવાસી** એ/૩-૮૦૩, સ્વસ્તીક રેસીડેન્સી, ઓમ્ દર્શનની પાસે, પોદાર રેસીડેન્સીની સામે, ન્યૂ ાં કહેલાલ ટોડ, તેયું, સુરત, ગુજરાત **તેઓ અહીં** પણ: ફ્લેટ નં. ૪૦૩, રવસીક રેસીડેબ મિદીલાઇટ કેનાલ ટોડ, તેયું, સુરત, ગુજરાત **તેઓ અહીં પણ:** ફ્લેટ નં. ૪૦૩, રવસીક રેસીડેબ બિલ્ડીંગ એ-૩, જી.ડી.ગોએન્કા સ્કુલની બાજુમાં, વેસુ સુરત, ગુજરાત ને **૩. ૧.૬૬.૧૯.૧૯**.૧ બિલ્ડીંગ એ-૩, જુ.ડી.ગોંએન્કા સ્કુર્વની બાલુમાં, વેસુ સુરત, ગુજરાત ને **રૂ. ૧,૯૬,૬૯,૧૬૭.૯૫ ૨૦-૦૫-૨૦૨૦** થી ચડત વ્યાજ) આ નોટીસ મળ્યાની તારીખ થી દિવસ ૬૦માં ચુકવી દેવા

જણાવવામાં આવ્યું હતું. દેવાદાર નોટીસમાં જણાવેલી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા દેવાદારોને ખાસ અને જનતાને જાહેર નોટીસ દ્વારા જણાવવામાં આવે છે કે , નીચે સહીં કરનારે ઉપરોક્ત એક્ટના ખંડ ૧૩ (૪) ની સાથે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોરીમેન્ટ રહ્ય ૨૦૦૨ના ફુલ ૮ અંતર્ગત આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ

કરતા **૧, િસેમ્બર, ૨૦૨૦** ના રોજ નીચેના વર્ણનવાળી મિલકતનો કળજો લીધો છે. ત્વાદારને ખાસ અને જનતાને આ જાહેર નોટીસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે, ખાઇઆરએઆરસીના કબજામાં રહેલી મિલકત પર દેવાદારો પાસેથી તા.૨૦-૦૫-૨૦૨૦ના રોજ . ૧,૬૬,૬૬,૧૬૦.૯૫ વતા વ્યાજ તથા અન્ય ખર્ચ સહીતની ૨કમનું લેધું નીકળે છે. તેમણે ૨ લકતનું કોઇપણ રીતે હસ્તાંતરણ કરવું નહીં.

આથી દેવાદારોનું કથીત એક્ટના ખંડ વર્ડ પેટા ખંડ (૮)ની જોગવાઇઓ તરફ દયાન દોરવામાં આવે છે કે, તેમની મિલકત પાછી મેળવવા માટે તેમની પારો હજુ પણ સમય છે. મિલકતનું વર્ણન તેમની માત્રે હંમ છે. મિલકતનું વર્ણન તેમની માત્રે કે અખંડિત ભાગની બનેલી મિલકત કલેટ નં. ૪૦૩, ચોથે માળે, ક્ષેત્રફળ ૧૧૦૪ ચો.કૂ. અથવા ૧૧૪.૫૦ ચો.મી. બિલ્ડ અપ એરીયાની સાથે ''રયસ્તીક સ્સીડેન્સી' બિલ્ડા નં. એ-3'ની અબિભાજીત જમીનનો ભાગ ૨૮.૨૫ ચો.મી. જે રે.સર્વે નં. ૮૫/૩, બ્લોક નં. ૧૮૫, ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૨ (વેસુ ભરવાણા વેસુ), ફા.પ્લોટ નં. ૧૮૯ ક્ષેત્રફળ દ્૧૭૧ ચો.મી. મોજે ગામ ભરવાણા વેસુ, સુરત સીટી, ખાતે આવેલી છે. અને તેની માલિકી અભિચમતીદેવી પ્રકાશકુમાર સાંખલેચાની છે.

પાગાન બરુ ક અખારત ભાગના બનલા મિલકત ફલેટ નં.૮૦૩, આઠમા માળે, ક્ષેત્રફળ ૧૧૦૪ થો.કૂ. અથવા ૧૦૨.૬૦ થો.મી. કાર્પેટ એરીયા અને ૧૨૩૨ થો.કૂ. અથવા ૧૧૪.૫૦ થો.મી. બિલ્ટ અપ એરીયાની સાથે 'સ્વસ્તીક રેસીડેન્સી બિલ્ડીંગ નં.એ-૩'ની અવિભાજીતજમીનનો ભાગ ૨૮.૨૫ થો.મી. જે રે.સર્વે નં. ૮૯/૩, બ્લોક નં. ૧૮૫, ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૨ (વેસુ-ભરથાણા-વેસુ), ફા.પ્લોટ નં. ૧૮૯ ક્ષેત્રફળ ૧૧૦૧ થો.મી. મોજે ગામ ભરથાણા વેસુ, સુરત સીટી, ખાતે આવેલી છે. તમામ ખંડ કે અખંડિત ભાગની બનેલી મિલકત ફ્લેટ નં.૮૦૩, આઠમા માળે, ક્ષેત્રફળ ૧૧૦

અધિકૃત અધિકારી મેસર્સ ઇન્ડિયા રીસર્જન્સ એઆરસી પ્રાઇવેટ લિમિટેડ

સુરતઃબોમ્બે માર્કેટમાં ખરીદી માટે આવતા ગ્રાહકોનો ટેસ્ટ કરવાની તુજવીજુ સામે વેપારીઓ રોષે ભરાયા કમિ. સજ્જઃ સલાબતપુરાની કામગીરી સામે પ્રશ્નાર્થ

બોમ્બે માર્કેટમાં ખરીદી માટે જતાં ગ્રાહકોના રહી છે ત્યારે બીજી તરફ કોરોનાનું ટેમ્પો આવી નહીં શકતાં હોબાળો થયો કોરોના ટેસ્ટ કરવા માટે માર્કેટના ગેટ બંધ સંક્રમણ વધતું રોકવા માટે પાલિકા દ્વારા હતો. જોકે, પછી સમજાવટને અંતે

કરવાની પાલિકા દ્વારા સૂચના આપવામાં આવતા માર્કેટમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારવામાં મામલો થાળે પડ્યો હતો. છે. આજે

બોમ્બે માર્કેટના પ્રેસિડેન્ટ બાબુ ાણ બોમ્બે માર્કેટમાં ચેવલીએ કહ્યું કે, લગ્નસરાના લીધ<u>ે</u> <u>પાલિકાની ટીમ દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી</u>

કેટલાક ગ્રાહકો ગભરાઈને અન્ય ગેટ ઉપરથી નીકળી જતાં મનપાએ તમામ પ્રવેશદ્વાર બંધ

ટેસ્ટીંગની માટે આવે છે. પરંતુ પાલિકાની ટીમની

હતી. તેમજ સમજાવટ કરીને કોરોનાનું

ચેકિંગ કરાવવા માટે સૂચન કરાયુ હતું.

કરાવી માત્ર એક ખુલ્લો રાખ્યો

કામગીરી હાથ ધરવામાં હાજરીના કારણે ગ્રાહક વર્ગ આવતો આવી હતી. જોકે, કેટલાંક અટકે નહીં તેની ચિંતા વેપારીઓમાં વેપારીઓ નારાજ થયા હતા અને તે મુદ્દે હોબાળો ગ્રાહકો તેનાથી ગભરાયને અન્ય ગેટથી જોવા મળી હતી. કેટલાંક ગ્રાહકો નીકળી જતાં બોમ્બે માર્કેટનો એક ગેટ અન્ય ચેકિંગ નહીં કરાવીને અન્ય લગ્નસરાના લીધે બોમ્બે માર્કેટમાં ખુલ્લો રાખી અન્ય ગેટ બંધ કરી દેવામાં ગેટથી નીકળી જતાં હોઈ છે. જેને પગલે પાલિકાની ટીમને માર્કેટમાં કેમ્પ લગાડવા એક જગ્યા આપવામાં આવી

કમિ. સજજ: સલાબતપુરાની કામગીરી સામે પ્રશ્નાર્થ સુરત, તાં. ૩ સુરત, પૂર્વાંગ રોડ પર આવેલા પોતાની વિગતો પોલીસને આપવાની

સુરતના રીંગ રોડ પર આવેલા કાપડના માર્કેટોમાં કાપડ ખરીદ કરીને રેહશે,કાપડ દલાલોનું તેમજ પેઢીઓની વિગતો પોલીસને જગજાહેરછે. આપવાની અને દલાલોનું પોલીસ

અલગ અલગ કાપડ માર્કેટોમાં થતી પછી તેના રૂપિયા નહિ ચૂકવીને ઠગાઈ વેરીફીકેશન કરાવવું પડશે. દુકાન કે છેતરપીંડી એ કઈ નવી વાત નથી. કરવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે મિલકત ભાડે આપે તો લેનાર અને જોકે આ ઠગાઈના કિસ્સાને રોકવા નોંધાયા છે.ભૂતકાળમાં અમુક પોલીસ ઓળખ આપનારની ખરાઈ કરાવવી માટે પોલીસ કમિશ્નર અજય તોમરે અધિકારીઓ અને કોન્સ્ટેબલ કક્ષાના પડશે. તેમજ ભાડાની ચુકવણી ચેકથી એક જાહેરનામું બહાર પાડીને કાપડના કર્મચારીઓ પણ આવા ઠગાઈના કિસ્સા કરવાની રેહશે.દરેક પેઢીઓ ના વેપારી સંગઠનો અને હોદ્દેદારો ને દલાલ માં વચલો રસ્તો કાઢીને સેટેલમેન્ટ ના માલિકોએ પોતાના કર્મચારીઓની અને વેપારીઓની માહિતી એકત્ર કરવી નામે પોતાના ગજવા ભર્યા હોય તે વાત બાયોમેટ્રિક વિગત અને ફોટા સાથેનું ઓળખ પત્ર બનાવવું પડશે.જોકે હવે જોકે આવા કિસ્સાઓને અટકવવા જોવાનું એ છે કે સલાબતપુરા પોલીસ વેરીફ્રીકેશન કરવું,ભાડાની ચુકવણી ચેક માટે પોલીસ કમિશ્નર અજય તોમરએ પોલીસ કમિશનરના જાહેરનામાનો થી કરવાની સૂચનાઓ આપી છે.જોકે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં અમલ કેવી રીતે કરાવે છે કારણ સલાબતપુરા પોલીસ આ બાબતમાં વિવિધ કાપડ વેપારી સંઘ અને માર્કેટના કે ઠગાઈના કિસ્સામાં કોઈ ઘટાડો હમેશા વામણી પુરવાર થઇ છે.પોલીસ હોદેદારો એ અમુક નિયમોનું પાલન થતો નથી અને અમુક કિસ્સામાં કમિશ્નરની સુચનાનું પાલન કરવામાં કરવાનું રેહશે અને તેમાં પોલીસને સલાબતપુરા પોલીસજ વચ્ચે પડીને સલાબતપુરા પોલીસ કેટલી સફળ થાય સહકાર આપવાનો રેહશે જેમાં તમામ સેટલ મેન્ટ કરવાતી હોવાનું પણ

अध्यात आडियन

વેપારીઓ અને પેઢીના સંચાલકોએ જાણવા મળી રહ્યું છે. છે તે વિચારવા જેવી બાબત છે. ઠગાઈના વિવિધ કેસમાં સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સમાધાનના ગજવા ભર્યાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા હતા

શાહલોન સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ

રજી. ઓફ્સિઃ ૯૧, જી.આઈ.ડી.સી., ખટોદરા, સબજેલની પાછળ, રીંગરોડ, સુરત-૩૯૫ ૦૦૨ CIN: L17120GJ2008PLC053464 | Tel No.: +91-261-419 0200 Fax: +91-261-263 5550 E-mail: info@shahlon.com | Website: www.shahlon.com

૧૨મી વાર્ષિક સાધારણ સભા, બુક બંધ, કિવિડન્ડ અને રીમોટ ઈ-વોર્ટીંગની માહિતીની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ૧૨મી વાર્ષિક (''એજીએમ'') શનિવાર, ૨૬મી ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સીંગ (''વી.સી.'') / અન્ય વિઝયઅલ માધ્યમો ("ઓએવીએમ") દારા ૧૨મી એજાએમ ની નોટીસ જણ કાર્યો પાર પાડવા માટે યોજાશે. ૧૨મી એજીએમની નોટીસ વર્ષ ૨૦૧૯–૨૦૨૦ ના વાર્ષિક એહવાલ સાથે જે ડીપોઝીટરી પાર્ટીશીપન્ટો (શેર ડીમેટ મોડમાં ધરાવનાર માટે) કંપની રજીસ્ટાર અને એજન્ટ બીગશેર સર્વિસીસ પ્રા.લી. (બીગશેર) (શેર ફીઝીકલ મોડમાં ધરાવનાર માટે) પાસે જે સભ્યોએ તેમના ઈમેલ એડ્રેસ રજીસ્ટર્ડ કરાવ્યા છે તેમને ઈમેલથી મોકલવામાં

કંપની કાયદા ૨૦૧૩ ની કલમ ૯૧ અને તે હેઠળ ઘડાયેલ નિયમો અને સેબી લિસ્ટીંગ રેગ્યુલેશન્સના નિયમો ૪૨ અંતર્ગત કંપનીના સભ્યોનું નોંઘણીપત્ર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક જો ૧૨મી એજીએમુ માં શેર હોલ્ડરો દ્વારા મંજૂરી મળે તો રૂ૧મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પુરા થતા વર્ષના ડિવિડન્ડ માટે હક્કદાર શેરહોલ્ડરો નક્કી કરવાના હેતુસર ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૦ થી રકમી ડિસેમ્બર, ૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) બંધ રહેશે. સભ્યોએ નોંધ લેવી કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તેમની ૧૧મી જુલાઈ ૨૦૨૦ ના રોજ યોજાયેલ

બેઠકમાં ૩૧ માર્ચ ૨૦૨૦ ના રોજ પુરા થતા વર્ષ માટે શેરહીઠ રૂા.૦.૨૫ (૨.૫ ટકા) ના ડિવિડન્ડની ભલામણ કરી છે. ડિવિડન્ડ જો એજીએમ માં સભ્યો દ્વારા મંજૂરી મળે તો સભ્યો જેમણે ઈલેક્ટોનિક માધ્યમોથી ડિવિડન્ડ મેળવવા માટે તેમની એકાઉન્ટ વિગતો આપેલ છે તેમને ઈલેક્ટ્રોનિક રીતે ચુકવવામાં આવશે. જે સભ્યોએ તેમની એકાઉન્ટ વિગતો આપી નથી તેમને ડિવિડેન્ડ વોરંટ / ડિમાન્ડ ડ્રાફ્ટ સાનુકુળ સમયે અને પોસ્ટલ સેવાઓ સામાન્ય થતા મોકલવામાં

ફાઈનાન્સ એક્ટ ૨૦૨૦ મુજબ્ ડિવિડન્ડની આવક શેરહોલ્ડરના હાથમાં કરપાત્ર બનશે જે ૧ એપ્રિલ ૨૦૨૦ થી લાગુ છે અને કંપની ઈન્કમટેશ એક્ટ, ૧૯૬૧ ("આઈટી એક્ટ") માં જણાવેલ દરો મુજબ સબ્યોને ચુકવાયેલ ડિવિડન્ડમાંથી કર ("ટીડીએસ") કાપવો આવશ્યક છે. વિવિધ કેટેગરીઓ માટે જણાવેલ દરો શૂન્ય / સવલત વાળા ટીડીએસ ની શરતો અને તેની જરૂરી વિગતો / દસ્તાવેજો માટે સુભ્યોને આઇટી એક્ટ અને આ સબંધિત એજીએમની નોટીસ જોવા વિનંતી છે જે સભ્યોને ઈમેઈલ દ્વારા મોકલાવવામાં આવી છે.

કંપની કાયદા ૨૦૧૩ની કલમ ૧૦૮ અને કંપની (વ્યવસ્થાપન અને પ્રાસાશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૦ સુધારા મુજબ અને તેની સેબીલીસ્ટીંગ રેગ્યુલેશન્સના નિયમન ૪૪ અને કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ) દ્વારા જારી કરાયેલ એસએસ–ર ના એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રો સાથે વાંચન અનુસાર કંપની એજીએમ માં પાર પાડવાના એજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો / ઠરાવોના સબંધમાં તેના સભ્યોને રીમોટ ઈ વોટીંગની સવલત અને એજીએમ માં ભાગ લેનાર સભ્યો માટે એજીએમ દરમિયાન ઈ–વોટિંગ પધ્ધતિ મત આપવા માટેની સવલત સીડીએસએલ દ્વારા પુરી પાડી રહી છે.

(૧) રીમોટ ઈ–વોર્ટીંગના કાર્ય, એજીએમમાં મતદાન અને એજીએમમાં ભાગ લેવા માટેની કટ—ઓફ તા.૧૮મી ડિસેમ્બર ૨૦૨૦ રહેશે.

(૨) રિમોટ ઈ–વોર્ટીંગનો સમયગાળો ૨૩મી ડિસેમ્બર, ૨૦૨૦ (સવારે ૯.૦૦ કલાકે) શરૂ થશે અને રૂપમી ડિસેમ્બર, ૨૦૨૦ (સાંજે પ.૦૦ કલાકે) બંધ થશે. જણાવેલ તારીખ અને સમય પછી રિમોટ ઈ–વોર્ટીંગ માન્ય ગણાશે નહીં.

(૩) જે વ્યક્તિનું નામ કટ–ઓફ તારીખના રોજ સભ્યોના નોંધણીપત્રક અથવા ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના નોંધણીપત્રકમાં નોંધાયેલ છે ફક્ત્ન તે જ્ રિમોટ ઈ–વોર્ટીંગ, એજીએમમાં ઈવોર્ટીંગ અને ૧૨મી એજીએમમાં વીસી / ઓએવીએમથી ભાગ લેવા હક્કદાર ગણાશે.

(૪) નોટીસની રવાનગી પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કૂંપનીના સૂભ્ય બનુનાર અને કટ–ઓફ તા. ૧૮મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ શેરો ધરાવતી કોઈપણ વ્યક્તિ કંપનીને સંપર્ક કરી લોગઈન વિગતો અને પાસવર્ડ / સીકવન્સ નંબર મેળવીને વોટ કરી શકે છે. જો તમે પહેલેથી જ સીડીએસએલ સાથે રજીસ્ટર છો તો તમારી પાસે રહેલ લોગઈન વિગતો અને પાસવર્ડ દ્વારા વોટ કરી શકો છો.

(૫) જે સભ્યોએ સભા પહેલા રિમોટ ઈ–વોટીગથી તેમના મત આપ્યા છે તે સભામાં પણ હાજર રહી શકે છે પરંતુ ફરીથી તેમના મત આપવા હક્કદાર ગણાશે નહીં.

(૬) કંપનીએ શ્રી ભૈરવ એચ. શુકલા, વ્યવસાયીક કંપની સેક્રેટરી (સીઓપી નં. એફ્સીએસ ડરવેર∫ ની રીમોટ ઈ–વોટીંગ અને વરમી એજીએમમાં ઈ–વોટીંગના યોગ્ય અને પારદર્શક રીતે સ્ક્રુટીનાઈઝ કરવા માટે સ્ક્રુટીનાઈઝર તરીકે નિમણુક કરી છે.

કોઈપણ સભ્યોને રિમોટ ઈ–વોર્ટીગ, એજીએમમાં ઈ–વોર્ટીગ અને વીસી / ઓએવીએમ દ્વારા એજીએમમાં ભાગ લેવા સંબંધિત કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યા હોય તો, તેઓ હેલ્પ સેક્શન હેઠળ www.evotingindia.com પર ઉપલબ્ધ વારવાર પુછાતા પ્રશ્નો (એકએક્યુએસ) અને ઈ– લોટીંગ મેન્યુઅલ જોઈ શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com પર મેઈલ લખી શકે છે અથવા નિતિન કુંદર (૦૨૨–૨૩૦૫૮૭૩૮) અથવા શ્રી મેહબુબ લાખાણી (૦૨૨–૨૩૦૫૮૫૪૩) અથવા શ્રી રાકેશ દલવી (૦૨૨–૨૩૦૫૮૫૪૨) પર સંપર્ક કરી શકે છે.

આ નોટીસ કંપનીની વેબસાઈટ www.shahlon.com અને સીડીએસએલ ની વેબસાઈટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

> શાહલોન સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના આદેશથી હિતેશ કે. ગરમોરા

ઘ ફેડરલ બેંક લી.: _{છ-૨}, સારથી રેસીડન્સી, સુરત–કડોદરા રોડ, કુંભારીયા, સુરત-૩૯૫૦૧૦

ગોલ્ડ લોન- વેચાણ નોટીસ

આથી તમામ સંબંધિતો અને જાહેર જનતાની જાણ અર્થે નોટીસ આપી જણાવવામાં આવે છે કે 🛭 ફેડરલ બેંકની કુંભારીયા શાખામાં નીચે જણાવેલ ગોલ્ડ લોન ખાતેદારને ગીરો મુકવામાં આવેલ સોનાના આભુષણો છોડાવવા માટે સમયસર ચુકવણું કરવામાં આવેલ નથી અને વારંવારની નોટીસ આપવા છતાં ચુકવણું કરાચેલ ન હોઈ, જો તે ખાતાઓ તા.૧૧/૧૨/૨૦૨૦ ના રોજ અથવા તે પહેલા બંધ કરવામાં નહીં આવે તો ખાનગી વેચાણ દ્ધારા વેચાણ કરવામાં આવશે ખાતેદારની વિગતો

Chelefell 140km					
ક મ.	કરજદારનું નામ	ખાતા નંબર	લોનની મુદ્લ રકમ (રૂપિયામાં)	ગ્રોસ વજન (ગ્રામમાં)	नेट वष्टन (ग्राममां)
٩.	ભાવેશ વેલજીભાઈ હિરપરા	50636800006053	3,00,000/-	9.00.5	૧૪૨
٤.	નારાચણ પરભુ	20535400038658	७५,०००/-	536.85	30
3.	नायङ नीतीनयंद्र नरोत्तमભाई	२० ۶३ ۶४०००० ۶۶ १ २	3,00,000/-	૧ ۶૮.૯७	૧૫૫
۲.	રાદ્યાબેન આર કુકાના	20535400034088	४,००,०००/-	58.48	50
ч.	મનીષાબેન ભરતભાઈ દિલ્હીવાલા	50636800006680	४,००,०००/-	કવ.૦૧	นน.0ใ
ç.	મનીષાબેન ભરતભાઈ દિલ્હીવાલા	20535800004530	१,१ ५,०००/-	น ช. e	પર
ဖ.	દિલ્હીવાલા ભરતભાઈ અશોકભાઈ	૨૦૬૩૬૪૦૦૦૦૯૧૫૨	3,00,000/-	994.50	૧૧૦
८.	સંજય પુરોહિત	२० ۶३ ۶ ९०००३४ 6 ۶3	90,000/ <u>-</u>	પર.પ૪	₹6.00
e.	વિષ્ણુ પુરાણ સિંગ	૨ ૦ ۶ 3 ۶ ૧૦૦૦3૪૫ ۶ ७	23,000/-	૧૫. ७७	૧૧.૫
90.	ક્રિરણ દેવી	20535400033556	१,४५,०००/-	७५.3४	७२.प
99.	મનોજ દેવનારાચણ સિંગ	50636800000336	૧,૨૫,૦૦૦/–	56.5	90
તારીખ : ૭૪/૧૨/૨૦૨૦ ઘ ફેડરલ બેંક લી., સ્થળ : કુંભારીચા શાખા પ્રબંધક, કુંભારીચા					

જાહેર નોટીસ એસ.એમ.રજવાડી, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત, સુરતની કોર્ટમાં વાદી/અરજદાર : ગોવિંદભાઇ જેઠાભાઇ કાકડીયા નં. જ. મ. પ્ર/એસ. રહે. બી/લ્જ,સમાટ સોસાયટી, સાગર સોસાયટીની બાજુમાં, તા. ૧૧/૧૧/૨૦૨૦

એલ.એચ.રીડ, સુરત. તિવાદી/સામાવાળાઃ જન્મ મરણ રજીસ્ટ્રારશ્રી, સુરત મહાનાગરપાલિકા, સુરત. વિચચ: જન્મમરણની નોંધણી અદિનિચમની કલમ ૧૩(૩) મુજબ જન્મમરણની નોંધણી કરાવવા બાબત. આથી આ જોહેર નોટીસથી લાગતા-વળગતા તમામ ઇસમીને જણાવવામાં આવે છે કે, સદર અરજીમ ખારા ખા જાહેર નાટાસથા લાગતા-વળગતા તમામ ઇસમાન જણાવવામાં આવે છે કે, સદર અરશુંના અરજદારથી ગોવિંદભાઇ જેબામ કાર્કડીથા, રહે. બી/લર, મમાટ સોમાયટી, સાગર સોસાયટીની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત ના દાદા જાદવાજીભાઇ આંબાભાઇ કાર્કડીયા નું અવસાન તા. રદૃ/૧૨/૨૦૦૩ના રોજ ૨-એચ, જુની શકિતવિજય સોસાયટી, વરાઇ! રોડ, સુરત ખાતે થયેલ છે. અને તેઓના અવસાનની નોંધણી જે-તે વખતે કાયદાથી અભા હોઇ ભૂલ અને શરત્યું કથી કરાવવાઓની રહી ગયેલી છે, તેની નોંધણી કરાવવા અભી કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંધણી કરાવવા સામાવાળાને હુક્મ કરવા સોમે કોઇ પણ ઇસમને વાંધો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦માં વાંધો રજુ કરતો. જો વાંધો નહીં આવે તો હોયો નાંધો અર્થી ક્ષ્મ મની આપાલી કાર્યાય કરાવા હોયો છે. તેમાં તો હોય પ્રસિદ્ધ થયેથી દિન-૩૦માં વાંધો રજુ કરતો. જો વાંધો નહીં આવે તો હોયો નાંધી અર્થી કાર્યાય હોયા હોય હોયા હોયો હોયો નોંધ હતી ાંદો નથી. તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગલ આજ રોજ તા. ૧૧/૧૧/૨૦૨૦ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આ

હુકમથી (એસ.એમ.રજવાડી) સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, અને નાયબ ક્લેક્ટર, સીટી પ્રાંત, સુરત

ઈ-ટેન્ડરિંગ ગુજરાવ સરકાર નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને ક્લ્પસર વિભાગ જાહેર નિવિદા નં.૦૬ સને ૨૦૨૦-૨૧

કાર્ચપાલક ઈજનેરશ્રી, ઉકાઈ જમણા કાંઠા નહેર સંશોધન વિભાગ, આઈ.ટી.આઈ.પાછળ, ઉકાઈ વસાહત, પીરામણ રોડ, અંકલેશ્વર પીન. ૩૯૩૦૦૧ (ફોન ૦૨૬૪૬૨૪७૪૦૩) દ્વારા નહેર સુધારણાનાં કુલ-૦૩ (ત્રણ) કામના ઓનલાઇન ટેન્ડર મંગાવવામાં આવેલ છે. કામ છે જેની અંદાજાત ૨કમ ૩. ૨૬.૮૯ થી ७.૮૧ લાખ છે

0101001 20 1 4: 03:00 41 4:01	
(અ) ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ/	તા. ૦૩/૧૨/૨૦૨૦ થી. ૧७/૧૨/૨૦૨૦
અપલોડ તારીખ અને સમય	સમય ૧૮.૦૦ ક્લાક
(બ) ફિજીકલ ડોકક્યુમેન્ટ	તા. ૧७/૧૨/૨૦૨૦ થી ૨૨/૧૨/૨૦૨૦
આ૨.પી.એ.ડી/કુરીય૨/સ્પીડ પોસ્ટથી	સમય ૧૮.૦૦ ક્લાક
સ્વીકારવાની તારીખ	

''ઈ-૨ એન્ડ એબોવ " ક્લાસ અને ઉપરની માન્ય શ્રેણીમાં નોંધાચેલ **ઇજારદારો દ્વારા ભરવાના રહેશે.** ટેન્ડર ખોલવાનું સ્થળ. તા.૨૩-૧૨-૨૦૨૦ ૧૨:૦૦ કલાકે અધિક્ષક ઇજનેરશ્રી સુરત સિંચાઇ વર્તુળ, સુરત. એમ.ટી. **બી. કોલેજની નજીક, અઠવાલાઇન્સ, સુરત.** ફોન (૦૨૬૪૬૨૪७૪૦૩) ટેન્ડર વેબસાઈટ https://nwr.nprocure.com વધુ માહીતી

www.statetenders.com ઉપર পોઈ શકાય/ઉપરોક્ત કરોરીએ જાહેર રજા સિવાયના દિવસોમાં સંપર્ક સાધવા વિનંતી છે.

(હવે પછી જે કાંઇ સુધારા-વધારા કરવામાં આવશે જે ઓનલાઈન (માહિતી-ભરૂચ-૫૩૦-૨૦૨૦-૨૧) જોવાના ૨હેશે.)

વિદ્યાર્થી <u>હિતના કામને મહત્ત્</u>વ આપવા મોંગ

નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં નાસાના કૌભાંડીઓને છાવરવા, કુલપતિનો બંગલો બનાવવા સહિતના આર્થિક હિતના કામોને બાજએ મુકી વિદ્યાર્થી હિતના કામોને મહત્વ આપવાની માંગણી સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી કોલેજની માત્ર ટયશન ફી લેવામાં આવે. અને અન્ય તમામ પ્રકારની ફી માફી થાય તેમજ બી.સી.એના અભ્યાસક્રમમાં વર્ગદીઠ

યુનિવર્સિટીના આર્કિટેકચર ડિપાર્ટમેન્ટમાં વર્ષ ૨૦૧૬માં આયોજીત કોલેજોને મંજૂરી આપવી, પ્રશ્નપત્રનું ઉપરાંત બીએચએમએસની સેકેન્ડથી નાસાની ઇવેન્ટની ગેરરીતી અંગે જે તે સીલ તોડનારાને સો રૂપિયાનો દંડ કરવો ફોર્થ યરની પરીક્ષા ઓનલાઇન લેવાની સમયે ઉઠેલા વિવાદ બાદ તત્કાલીન જેવા અનેક પ્રકારના વિવાદિત મુદ્દો પર માંગણી કરવામાં આવી હતી. કુલપતિ દક્ષેશ ઠાકર અને ત્યારબાદ ચર્ચા વિચારણા કરી નિર્ણય લેનારા છે. ર્શિવેન્દ્ર ગુપ્તાએ પણ બાકી પેમેન્ટ આપવા 🛮 જો કે, આ બેઠકમાં વિદ્યાર્થીઓને હીત આવેલા વિરોધ પ્રદર્શનમાં સિન્ડીકેટ સભ્ય મુદ્દે કોઇપણ પ્રકારનો નિર્ણય કર્યો ન હતો. થાય તેવા પ્રકારના એકેય મુદ્દા મૂકાયા ન ભાવેશ રબારી, એનએસયુઆઇના પ્રદેશ પરંત ઇન્ચાર્જ કલપતિ હેમાલીબેન દેસાઇ હોવાના આક્ષેપો સાથે એનએસયુંઆઇએ પ્રભારી સતવીર ચૌધરી, તથા પ્રદેશ પ્રમુખ દ્વારાં નાસાની ઇવેન્ટના બાકી પેમેન્ટ પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ મહિપાલસિંહ ગઢવી સહિતના હોદ્દેદારો ચુકવવા માટે ઉતાવળ કરવામાં આવી વિદ્યાર્થી હીતમાં વિદ્યાર્થીઓ પાસેથી રહી હોવાના આક્ષેપો એનએસયુઆઇ માત્ર ટ્યૂશન ફી ઘટાડીને જ લેવાય અને ચોક્કસ તત્વોના આર્થિક હિતને બાજુએ દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તે સિવાયની તમામ ફી માફ કરવામાં મુકી વિદ્યાર્થીઓના હિતના કાર્યને મહત્વ સિન્ડિકેટમાં કલપતિનો બંગલો, પાંચ આવે, આ ઉપરાંત શહેરની બીસીએની આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી.



બી.સી.એના અભ્યાસક્રમમાં વગદાઠ બેઠક વધારવાની માંગણી કરવામાં આવી BCAના અભ્યાસક્રમમાં વર્ગેદીઠ બેઠક વધારવા NSUIની રજૂઆત

એકર જમીન નહીં ધરાવતી નર્સિંગ કોલેજોની વર્ગદીઠ બેઠક વધારો કરવા,

એનએસયુઆઇ દ્વારા કરવામાં હાજર રહ્યા હતા. અને યુનિવર્સિટી

હોસ્પિટલમાંથી પીવીએસ શર્માને રજા મળતા તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવાયા હતા. દરમિયાન આ કેસમાં સીતારામ અને મુખ્તારએ જામીન અરજી કરી હતી. જેની સામે ઇન્કમટેક્સ વિભાગે સોગંદનામુ કર્યું હતુ જ્યારે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરીને જામીન

YES // BANK

દ્ધાંય ઓફીસ : પહેલો માળ, ઓર્બીટ ટાવર, કૃષી બજાર સામે, સહારા દરવાજા, રીંગ રોડ, સુરત – ૩૯૫૦૦૨. **રજીસ્ટર્ડ એન્ડ કોર્પોરેટ ઓફીસ** : ચશ બેંક ટાવર, વન ઈન્ટરનેશનલ સેન્ટર, ૧૫મો માળ, સેનાપતી બાપટ માર્ગ એલ્ફીસ્ટોન, (વેસ્ટ) મુંબઈ - ૪૦૦૦૧૩. CIN: L65190MH2003PLC143249, Email: communications@yesbank.in, Website: www.yesbank.in

સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ

સિક્યુરીટાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ ના રૂલ ૮(૬) ની જોગવાઇઓ વંચાણે લેતા સ્થાવર મિલકતો માટે ઇ-દરાજી થી વેચાણની નોટીસ. આથી ખાસ કરીને ઉદ્યારકર્તા(ઓ) અને જામીનદાર(ઓ) તેમજ સામાન્ય રીતે જાહેર જનતાને નોટીસ આપી જણાવવાનું કે નીચે જણાવેલ સ્થાવર મિલકત જે મુકરર લ્હેણદારને ગિરવે મુકેલ/તારણમાં મુકેલ છે જેનો પ્રત્યક્ષ કબજો ચશ બેંક લી. મુકરર લ્હેણદારના અધિકૃત અધિકારીએ લીધેલ છે, તે "જેવું છે જયાં છે", "જે છે તે છે" અને "જે છે ત્યાં છે" ના ધોરણે તારીખ ૨૩.૦૧.૨૦૨૧ ના રોજ મે. દીવ્યા સેલ્સ વર્તી તેમના પ્રોપરાઇટર શ્રી કેમચુઝ આર. સારંગ (ઉદ્યારકર્તા), શ્રી કેમચુઝ આર. સારંગ (ગિરવેદાર અને જામીનદાર નં. ૧) અને શ્રીમતી દાર્મિષ્ઠા સ્સીકભાઇ સારંગ (ગિરવેદાર અને જામીનદાર નં. ૨) પાસેથી મુકરર લેણદારળાં તા. ૦૨.૦૨.૨૦૧૮ ના રોજ બાકી લેણા રૂા. ૧,૯૯,૯૨,૫૦૨.૭૮/- કરાર દરે વ્યાજ અને ચાર્જીસ વસુલ કરવા વેચાણ કરાશે. અનામત કિંમત રૂા. ૬૬,૦૦,૦૦૦/- અને અર્નેસ્ટ મર્ન

કોમર્શિયલ મિલકત જેનું માપ કર.૨૪૫૦ સ્કે.મી. ગ્રાઉન્ડ ફ્લોર અને ૪ અપર ફ્લોર ખાતે આવેલ વોર્ડ નં. ૧, નોંધ નં. ૯૯૩/એ-૧/એ-૧/૨/બી/૧/૩ પૈકી ઉત્તર દિશાએ ખારવાવાડ, એસ.બી.આઈ. બેંકની સામે, નાનપુરા, સુરત - ૩૯૫૦૦૧.

- ઈ-હરાજીની તારીખ અને સમય : ૨૩.૦૧.૨૦૨૧, સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ દરકે ૫ મિનીટના વધારા સાથે
- બીડ મોકલવાની છેલ્લી તારીખ : ૨૦.૦૧.૨૦૨૧, ૦૪:૦૦ વાગ્યા સુધી

મિલકત નિરીક્ષણની તારીખ : ૧૬.૦૧.૨૦૨૧, સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦

વેચાણ માટેની વિગતવાર નિથમો અને શરતો જોવા મહેરબાની કરીને આપેલ લીંક http://10.0.49.5/about-us/media/auction-property મુકરર લેણદાર ની વેબસાઇટ : www.yesbank.in અથવા https://sarfaesi.auctiontiger.net જૂઓ. જો ટેન્ડર ડોક્ચુમેન્ટસ ઇ–બીડીગ કેટલોગ મેળવવામાં અથવા સ્થાવર મિલક્ત મુકરર મિલક્તની નિરીક્ષણમાં તકલીફ હોય અને કોઇ કવેરી હોય તો મહેરબાન

કરીને ચશ ભેંક લી. ના અધિકારીનો સંપર્ક કરવો, શ્રી નિતેશ જેન, મો. ૯૯૯૮૯૦૭૫૦૦ અથવા ઇમેલ: nitesh.jain3@yesbank.in અને મે. ઈ-પ્રોકસુરમેન ટેક્નોલોજીસ લીમીટેડ (ઓક્સન ટાઈગર) અમદાવાદ, બીડર સપોર્ટ નંબર : લ્સ્કપપક્સ્ટર૧, ૦૭૯ - ક૧૨૦૦૫૯૪ / ૫૯૮ / ૫૬૮ / ૫૮७ / ૫૩૮, ઈમેલ gujarat@auctiontiger.net અને chintan.bhatt@auctiontiger.net નો સંપર્ક કરશો કાયદાની કલમ ૧૩(૮) હેઠળ ધ્યાન કરતા અમારા લ્હેણાં, અમે કરેલા બધા ખર્ચાઓ, ચાર્જુસ, કોસ્ટ, સાથે વેચાણ અથવા તબદીલની તારીખ પહેલાં કોઇપણ સમયે ભરપાઈ થાય

એ સંજોગોમાં અમારા દ્વાર મુકરર મિલકતોનું વેચાણ અથવા તબદીલ થશે નહી અને મુકરર મિલકતનના વેચાણ અથવા તબદીલ માટેના આગળ પગલાં ભરાવશે નહી ઉદ્યારકરર્તા / જામીનદારોને વેચાણ નોટીસ

ઉપરોક્ત પ્રકાશનની તારીખથી ૩૦ દિવસની અંદર ચુકવવા માટે જવાબદારોને નોટીસ તરીકે ગણવામાં આવશે

સહી/-અધિકૃત અધિકારી, ચશ બેંક લીમીટેડ

૨.૭૦ કરોડની છેતરપિંડીમાં સીતારામ અને મુખત્યારની જામીન અરજી નામંજર **સુરતઃ** શહેર ભાજપ ઉપ**ેં**પ્રમુખ

પીવીએસ શર્માએ ગર્વમેન્ટ એજન્સીઓ તેમજ ડીએવીપીની રૂ.૨.૭૦ કરોડની જાહેરાત મેળવી લઇ છેતરપિંડી કરી હતી આ કેસમાં પીવીએસ શર્માના માણસો ગણાતા સીતારામ અને મુખ્ત્યારે જામીન અરજી કરી હતી. જેની સામે ઇન્કમટેક્ષ વિભાગે સોદંગનામું રજુ કર્યુ હતું. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે બંનેના જામીન નામંજુર કર્યા હતા. શહેર ભાજપના ઉપ પ્રમુખ પીવીએસ શર્મા વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકે ગર્વમેન્ટ એજન્સીઓ તેમજ ડીએવીપીની રૂ.૨.૭૦ કરોડની એડર્વટાઇઝમેન્ટ મેળવી લઇ ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન દિવાળીના દિવસે પીવીએસ શર્માએ નવસારી ખાતે તેના મિત્રના ઘરે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન નામંજૂર કરવા માટે દલીલો કરી હતી. કોર્ટે બેંને પક્ષોની દલીલો બાદ બંનેના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

SVNITમાં ૭મીથી ઓનલાઈન પરીક્ષા યોજાશે

કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે અગાઉ પણ એસવીએનઆઇટી દ્વારા પરીક્ષા લેવા ઉપરાંત વિદ્યાર્થીઓને ઓનલાઇન ડિગ્રી પણ આપી દેવામાં આવી હતી. તેમજ ઓનલાઇન શૈક્ષણિક સત્રનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. એજ રીતે હવે એસવીએનઆઇટી દ્વારા એન્ડ સેમેસ્ટર-ડિસેમ્બરની ઓનલાઇન પરીક્ષાઓનું સમય પત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ૭ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીમાં વિવિધ અભ્યાસક્રમના એન્ડ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષના અભ્યાસક્રમના પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટર જયારે ચાર વર્ષના અભ્યાસક્રમની ૭ અને ૮ સેમેસ્ટરની વિવિધ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવશે, એમસીક્ય બેઝ્ડ પરીક્ષાઓ હોવાથી વિદ્યાર્થીઓ સરળતાથી ઘરેથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્થળઃ સંકવ <mark>તારી</mark>ખઃ ડિસેમ્બર ૦૩, ૨૦૨૦

કંપની સેક્રેટરી Printed by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin-Palsana Road, Near Sachin-Surat on behalf of owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Suman Darwaja, Ring Road, Ring Road, Ring Road, Ring Road, Ring Road,

તારીખ : ૦૪.૧૨.૨૦૨૦, સ્થળ : સુરત